

સર્વ ત્રીજો

ખોજ માટેનું આમંત્રણ

વસ્તુનિર્દેશ

નવસર્જનના મોખરા જેવું પ્રભાત આવ્યું. વિશાળતર સૂર્યપ્રકાશે વૃક્ષોમાં એક કંપ વ્યાપ્યો, આનંદના આગમને અંતરાત્મામાં વ્યાપી જાય છે તેવો. પર્ણપુંજે છુપાયેલા કોકિલે સૂરીલો ટહુકો કર્યો, પરંતુ તે વખતે રાજા અશ્વપતિ જગતના મર્મર ધ્વનિઓથી વિમુખ અવસ્થામાં અગોચર અવાજો તરફ વળ્યો હતો. જીવનને વર્તુલના ધેરામાં પૂરી રાખનારાં બારણાં સૂક્ષ્મમાં ઉઘડુયાં અને વણજન્મી શક્તિઓનો દબાઈ રહેલો સ્વર એણે સાંભળવા માંડ્યો. પૂર્ણતાનું ધામ બનેલું જીવન, ચંચલ મનની નિશ્ચલતા અને નિશ્ચિતતા, રાહુગ્રાસથી મુક્ત થયેલો આનંદ, અજ્ઞાનમાં પરમ સત્યનું પ્રાકટય, ને મત્યોને અમરો બનાવી દેતી દૈવતાઈ જંખનની એક જબરજસ્ત જ્વાળા જાગી ને વિચારનાં વ્યોમમંડળોમાંથી ઉઠેલો એક શબ્દ અશ્વપતિના મસ્તિષ્કમાં પ્રવેશ્યો ને પડ્યા પાડવા લાગ્યો :

"કોઈ એક શક્તિનાં ચલાવ્યાં ચાલનારાં ને દૈવથી હંકારાતાં ઓ પૂઢ્યીનાં સંતાનો! તમારા ક્ષુદ્ર 'અહં' ની ને તુચ્છ વસ્તુઓની આસપાસ કયાં સુધી ચક્કરો માર્યા કરશો? અમૃતતત્ત્વમાંથી તમે ઉત્પન્ન થયેલાં છો, તમારું જીવન વૃદ્ધિ પામતા દેવો માટેનું બદલાતું બીબું છે, તમારી ભીતરમાં એક દિવ્ય દ્રષ્ટા છે, એક મહાન ઝષ્ટા છે, એક અણીશુદ્ધ દિવ્ય મહિમા છે. તમે પરમાત્માના વાતાવરણમાં પ્રબુદ્ધ થઈ શકો છો, મનની દીવાલોને તૂટી પડતી જોઈ શકો છો, સૂર્યની દૃષ્ટિએ પ્રકૃતિ પાર જોઈ શકો છો, સનાતનને બારણે જઈ તમારો પાંચજન્ય વગાડી શકો છો. પૂઢ્યીના પરમોચ્ય રૂપાંતરના તમે વિધાયકો છો, આત્માની ભોમના ભયપ્રેરક અવકાશો પાર કરીને પરાશક્તિના સ્વરૂપનો માતૃ-સ્પર્શ પામી શકો છો, માંસમાટીના ધરમાં સર્વશક્તિમાનનો સમાગમ સાધી શકો છો અને બહુસ્વરૂપધારી એક સ્વરૂપની સાથે જીવનને એકાકાર બનાવી શકો છો.

પરંતુ તમે જ્યાં પગલાં ભરો છો તે પૂઢ્યીની ને સ્વર્ગની વચ્ચે એક

આડો પડદો પડેલો છે. તમારાં બારણાં આગળ થઈને જાજવલ્યમાન અમર શક્તિઓ આવજી કરે છે. તમારા ક્ષુદ્ર સ્વરૂપની મર્યાદા ઓળંગી આગળ જવા માટેનાં રણશિંગાં તમને બોલાવે છે. માણસોમાંથી થોડાક તો આ સાંભળે છે ને તેથીય થોડા તે માટેની અભીષ્ટા રાખવાની હામ ભીડે છે. આશાનું ને નિષ્ફળતાનું મહાકાવ્ય પૃથ્વીના હંદયને ભર્ણ બનાવી રહ્યું છે. એના સ્વરૂપ ને ભાગ્ય કરતાં એની શક્તિ અને સંકલ્પ વધારે મોટાં છે. અચેતનતાની જાળમાં ફસાઈ ગયેલી એ એક દેવી છે. મૃત્યુનાં ગોચરોમાં સ્વયંબદ્ધ એ જીવનનાં સ્વર્ણ સેવે છે, નરકની યાતનાઓ જાતે વેઠતી એ આનંદ માટે અભીષ્ટા રાખતી રહે છે. એને ખબર છે કે એક ઉચ્ચગામી પગલું સર્વને મુક્ત મુક્ત બનાવી દેશે. પોતે દુઃખમાં પડેલી હોવા છતાં એ પોતાનાં બાળકોને માટે મહિમાની માગણી કરે છે.

મનુષ્ય પોતે મર્યાદિત હોઈ પરમોચ્ચનેય મર્યાદિત રૂપે જુએ છે, અદ્ય લાભો માટે એ અજ્ઞાનની શક્તિઓ પ્રત્યે વળે છે, આસુરી શક્તિઓના યજન માટે પોતાની વેદિઓ પ્રદીપ્ત કરે છે. દુઃખની માતા એવી અજ્ઞાનતાના પ્રેમમાં એ પડેલો છે, એના અંતરાત્માનો અવાજ માર્યો ગયો છે. એના મંદિરમાં એણે અસત્ત મૂર્તિ પદ્મરાવી છે, મહામાયાની છાયાએ એ ઘેરાઈ ગયો છે. એના ઉદ્ધાર માટે જે કંઈ ઉધત થાય છે તે બધું જ નિષ્ફળ નીવડે છે. હજુ સુધી બહુ થોડાક જ દેવતાઓ મર્ત્ય દેહમાં દેખા દે છે."

આ શબ્દો ગૂઢ ગગનોમાં પાછા ફરી ગયા, પણ દેવોના દેદીઘ્યમાન ઉત્તરરૂપ સૂર્યોજ્જવલ અવકાશોમાં થઈને સાવિત્રી ત્યાં ઉપસ્થિત થઈ. રાજર્ષિ અશ્વપતિ અંતરની દૃષ્ટિથી એને જોઈ રહ્યો હતો. સાવિત્રીમાં એને એના અદ્ભુત સ્વરૂપનું દર્શન થયું, અને આપણા કવિએ તો એના મુખ દ્વારા સાવિત્રીના દિવ્ય છતાં માનુષી અને માનુષી છતાં દિવ્ય સ્વરૂપનું કવિત્વની પરાકાષ્ઠાએ પહોંચતું વૈભવી વર્ણન કર્યું છે. પોતાની પુત્રી રૂપે પ્રકટ થયેલી સવિતૃદેવંની તેજોમયી શક્તિનાં દર્શન થતાં ઋતોના રાજાનાં અંતઃકરણમાં અસીમનાં ક્ષેત્રોના વિચાર જાગ્યા. અને પ્રેમનાં ગહનોમાંથી પોતાની પ્રત્યે જોઈ રહેલી એ દેવમાનવ મૂર્તિને આત્માનાં શિખરો પરથી અવલોકતો રાજા આ પ્રમાણે સંબોધન કરવા લાગ્યો. આપણાં જીવનોને પલટાવી નાખે એવાં એનાં સહજ સ્હુરેલાં આકસ્મિક વાક્યો જાણો કોઈ નિગૂઢ રહીને બોલાવતું ન હોય એવા પ્રકારનાં હતાં. ભાગ્યનિમંજના શબ્દો

એને ઓઠે સરકી આવ્યા :

"ઓ શાશ્વતીની યાત્રાએ નીકળેલા આત્મા ! જીવનનાં જબરાં જોખમોની સામે શસ્ત્રસજ્જ બનીને આવેલા ઓ આત્મા ! યદૃચ્છા અને ભવિતવ્યતાને માથે તારાં વિજયી પગલાં માંડ. કોઈ પુરુષોત્તમને માટે પ્રારબ્ધે તને સાચવી રાખી છે. તું આ જગતમાં એકલવાયી રહેવા માટે આવેલી નથી. પ્રેમનું પવિત્ર સૌન્દર્ય તારા નિષ્કલંક કૌમારમાં જીવંત રૂપે આલેખાયેલું છે. સ્વર્ગીય સામર્થ્યનો ને સંમુદ્ધાનો સંદેશ લઈને તું આવેલી છે. જેની આગળ તું તારું દૈવી હૃદય ઉઘાડશે તેને તે સર્વ પ્રાપ્ત થશે અને એની સહાયથી એ પોતાના જીવનને મહિમાવંતું બનાવી દેશે.

તું હવે આ મહાન જગતની જાત્રાએ જી અને તારા આત્માના આત્મા જેવો જીવનસાથી શોધી લાવ. એ તારું પોતાનું જ અન્ય સ્વરૂપ હશે. એની સાથે તારી સહયાત્રાને માર્ગ તું આગળ વધ. તારી મૂળી જીવનવીણાને ઝંકાર કરતી બનાવી શકે એવા વીજાવાદકને શોધી લાવ, ને એની સાથે હાથ શું હાથ મિલાવી સ્વર્ગના જીવનરૂપ મહાપ્રશ્નનો તું સામનો કર. છદ્રવેશી અનિન્પરીક્ષાઓને તું પડકાર હે, પ્રકૃતિતલથી પ્રભુનાં શિખરોએ આરોહ, પરમસુખના મુકુટધારી દેવોની સંમુખીન થા, અને કાળની પારના તારા મહત્તર પરમાત્મસ્વરૂપનો ભેટો કર."

સાવિત્રીનાં બંધ બારણાં ઊધડી ગયાં ને એમાં થઈ એની દિવ્ય શક્તિઓ અંદર પ્રવેશી. તે રાત્રિને અંતે પ્રભાત પહેલાં તો એ વિશાળ વિશ્વમાં પોતાના પ્રેમના પ્રભુની શોધમાં નીકળી પડી.

નવા સર્જનનો અગ્રભાગ જે લાગતું હતું
તે સુપ્રભાત આવ્યું ને લાવ્યું સૂર્યપ્રભા એક મહત્તરા,
વધારે સુખિયાં સ્વર્ગો લાવ્યું એહ,
વસ્તુઓના સદાસ્થાયી મૂળમાંથી આવે છે જે પ્રકાશમાં
તે સંચાલિત સૌન્દર્યે ચિત્રચિત્ર પ્રકારના

ભારોભાર લદાયલું.

પ્રાચીન એક ઉત્કંઠ અભીષ્ટાએ નાખ્યાં મૂળ નવાં ફરી.
હવાએ ધૂંટડો ઊડો ભર્યો પૂર્ણ ન થયા અભિલાષનો;
ભમતા વાયુની લહેરે તરુ ઊચાં પ્રકંપતાં,

કંપે છે જેમ ચૈત્યાત્મા પાસે આનંદ આવતાં,
અને હરિત એકાંતતણે હૈથે સૂરીલી એક કોકિલા
હરહંમેશ અશ્રાંત પ્રેમના એક રાગથી
પાંડાંમાં દુષ્કાર રવે મચી.
કાણભંગુર સાદો ને જવાબો જ્યાં બને મિશ્રપ્રવાહના
ત્યાં પૃથ્વીના મર્મરાટથકી દૂર વળી જઈ
રાજા અશ્વપતિ શ્રોત્ર માંડી કિરણમધ્યથી
શ્રવણેન્દ્રિયને ભેટે તેથી ન્યારા અવાજો સુણતો હતો.

આપણી જિંદગીકેરી આસપાસ રહેલ છે

તે સૂક્ષ્મ અંતરાલમાં

અંતરાત્માતણાં દ્વારો વસાયેલાં સમાધિએ

ઉદ્ઘાટિત થઈ ગયાં:

અશ્રાવ્ય જે હતો સૂર નિસર્ગો તે સુણાઈ શકતો હતો;
ઉત્કંઠ જીવનોની આ યુગોકેરી પદ્યાત્રામહી થઈ,
વર્તમાનતણી ચિંતાજાળકેરી ઊરી તાકીદમાં થઈ,
વિશ્વની રિફ્રતતાકેરા તીવ્રોત્સાહે ભરેલા હાઈમાંહથી
નિઃશબ્દ સ્તોત્ર પૃથ્વીનું અનિવચ્ય પ્રત્યે ઊરી રહ્યું હતું;
કાળના ઊજળા આડા આગળાઓતણી પૂઠળ ગુંજતો
ન જન્મેલી શક્તિઓનો સ્વર એણે સુણ્યો દાખી રખાયલો.
ફરીથી જવાણ પોતાની ઊંચે પ્રેરી રહી જગ્બર જંખના,
માગતી માનવો માટે પૂર્ણતાની જિંદગી પૃથિવી પરે,
પ્રાર્થતી દ્વુવતા એહ મને અદ્વુવતાભયી,
દુઃખ સ્હેતાં મનુષ્યોનાં ફદ્યો કાજ માગતી

છાયામુક્ત મહાસુખ

માગતી મૂર્ત એ સત્ય અજ્ઞાન જગની મહી,
મર્ત્ય સ્વરૂપને દિવ્ય બનાવી હે એવું દૈવત માગતી.
કૂદીને એક આવેલો શબ્દ કોઈ

દૂરકેરા વ્યોમમાંથી વિચારના

અવગુંઠિત સત્કારી લેનારા લિપિકારના

દ્વારા પ્રવેશ પામતો,

એના મહિસુદ્ધિના માર્ગો ધ્વનાવંતો તેમની પાર સંચયો,
અંકિત કરતા જીવકોષો ઉપર છાપ એ
પોતાની મૂકતો ગયો.

"લોકો ઓ જગતી-જાયા! શક્તિકેરા ઢાબને વશ વર્તતા,
હંકારાયેલ હૈવથી,

કૃદ્રા સાહસિકો ઓ હે! અનંત જગની મહી,
બંદીવાન બનેલાઓ! વામણી મનુ-જાતિના,
કયાં સુધી ચાલતા રે'શો મનનાં ચક્કરોમહી,
તમારી લઘુ જાતની

ને તુચ્છ વસ્તુઓકેરી આસપાસ ફર્યે જતા ?
પરંતુ પલટાયે ના એવી એક કૃદ્રતામાં જ જીવનું
એ હતો નહિ ઉદેશ તમારી જિંદગીતણો,
અમથી પુનરાવૃત્તિ માટે ઘાટ ઘડાયો તમ ના હતો;
અમૃતાત્માતણા આદિ-દ્રવ્યમાંથી બનાવાયા હતા તમે;
શિદ્ધ આવિષ્કારકારી પગલાંઓ તમ કર્મો બની શકે,
વૃદ્ધિ પામંત દેવોને માટે બીબું
બદલાતું બની જાય એવી છે તમ જિંદગી.

ભીતરે એક છે દ્રષ્ટા, દ્રષ્ટા એક સમર્થ છે,
વિશુદ્ધ મહિમા દિવ્ય કરે ચિંતા તમારા દિવસોતણી,
બંદી પ્રકૃતિના કોષોમહી સર્વશક્તિમાન બળો રહ્યાં.

તમારી સંમુખે વાટ તમ જોતું ભાવિ એક મહત્તરઃ
સંકલ્પ જો કરે સત્ત્વ આ અનિત્ય જાયેલું જગતીથકી
તો પોતાનાં કર્મને એ

સર્વોચ્ચ યોજના સાથે મેળમાં મેળવી શકે.

અત્યારે જે અજ્ઞ આંખે તાકે છે જગની પ્રતિ
ને અચિત્ની રાત્રિમાંથી જાગેલો માંડમાંડ છે,
જુએ છે પ્રતિબિંબોને ને જુએ નહિ સત્યને,

તે મનુષ્ય દૃષ્ટિથી અમરોતણી
એ આંખોને ભરી શકે.

તમારાં હૃદયોમધ્યે દેવતાત્મા તે છતાં વૃદ્ધિ પામશે,

બ્રહ્મકેરી હવામાંહે તમે પ્રબોધ પામશો,
ને તૂટી પડતી જોશો દીવાલો મર્ત્ય ચિત્તની,
મૂગું છોડ્યું હતું જેણે હૈયાને જિંદગીતણા

તે સંદેશો તમે સાંભળશો અને
જોશો પ્રકૃતિની પાર પોપચાંએ સૂર્ય પે મીટ માંડતાં,
ને સનાતનને દ્વારે શંખો તમ વગાડશો.
પ્રવર્તકો ઘરાકેરા મહોચ્ચ પલટાતણા,
ચૈત્યાત્માનાં ભયે પૂર્જ સ્થાનો સંકામવાતણું,
પૂર્જ પ્રબુદ્ધ ઓજસ્વી માનો સ્પર્શ

પામવાનું કામ છે તમને મળ્યું,
તમારે મળવાનું છે દેહગેહમહી સર્વસમર્થને,
કોટાનુકોટિ છે જેનાં અંગો એ એકરૂપનું
સ્વરૂપ સર્જવાનું છે તમારે જિંદગીમહી.
જે પૃથ્વી પર ચાલો છો તમે તે તો માત્ર એક કિનાર છે,
એની ને સ્વર્ગની વચ્ચે પડદો એક છે પડ્યો,
જે જ્યોતિ છો તમે પોતે તેને રાખે સંતાડી તમ જિંદગી.
તમારાં બારણાં પાસે થઈ અમર શક્તિઓ

ભભૂકૃંતી વેગે પસાર થાય છે;
તમારાં શિખરો માથે દૂર દૂર ધ્વને છે દેવ-ગીતડાં,
તૂર્યો વિચારનાં જાત પાર જાવા તમને હાંક મારતાં,
થોડાક સાંભળે છે એ, એથી થોડા

હામ ભીડે અભીષ્ટા રાખવાતણી,
મહામુદા અને દીપ્ત જવાલાના છે એ થોડા પ્રેમ-પાગલો.
આશા-નિષ્ફળતાકેરું મહાકાવ્ય ભાંગે દૃદ્ધ ભૂમિનું;
એનું ઓજ અને એની ઈચ્છાશક્તિ
અતિકાંત કરે એના રૂપને અથ ભાગ્યને.

અચેતનતણી જાળે દેવી એક જલાયલી
મૃત્યુને ગોચરે જાતે બદ્ધ, સ્વખ સેવતી જિંદગીતણાં,
નારકી યાતનાઓને જાતે સ્હેતી, આનંદાર્થ અભીષ્ટતી,
વિરચંતી નિરાશાની પોતાકેરી વેદિઓ આશ કારણે,

જાણતી કે એક ઊંચું પગલું સૌ મુક્ત મુક્ત બનાવશે,
દુઃખિયા ધરતી ખોજ મહિમાની

પુત્રો માટે પોતાના કરતી જતી.

પણ અંધારથી ધેર્યો માનવી ફંદયોમહી

અજિન એક છે ઊંચે અધિરોહતો,

અદૃશ્ય મહિમાધામ વિરાજે છે વણપૂજાયલું તહી;

મયદા બાંધતા રૂપમહી જોતો મનુષ્ય પરમોચ્યને,

અથવા માંડતો દૂષ્ટિ વ્યક્તિસ્વરૂપની પરે,

સુણતો એક નામ વા.

તુચ્છ મેળવવા લાભ વળે છે એ અશાન શક્તિઓ પ્રતિ,

યા દીપકો પ્રજાળે છે વેદિકેરા આસુરી મુખ અર્થવા,

દુઃખોત્પાદક અશાન પર એ પ્રેમ રાખતો.

એનાં યશસ્ય ઓજો છે મંત્રતંત્રકેરા પ્રભાવની તળે.

દોરતો જે હતો એના વિચારોને

તે ગુમાવ્યો છે મનુષ્યે અવાજ અંતરાત્મનો,

અને છંગે છુપાવીને દેવવાઙ્મિતણું ત્રિપાદ-આસન

સત્યાભાસી મૂર્તિ એક ચમતકારી મંદિરે છે ભરાયલી.

મહામાયા લપેટે છે એને પોતાતણાં આવરણોમહી,

આત્માનાં સૂચનો ઊંડાં બની નિષ્ફળ જાય છે,

નિષ્ફળા નીવડે લાંબી દ્રષ્ટાઓની પરંપરા,

મુનિઓ ધ્યાનનું કાર્ય કરે નિઃસાર જ્યોતિમાં,

સમર્પે બાહ્ય સ્વખાનાંને કવિઓ કાવ્યના સ્વરો,

આગાર વણનો અજિન જિહ્વવાઓને પ્રેરે પેગંબરોતણી.

સ્વર્ગની ઊતરે કિંતુ ફરે પાછી જાજીવલ્યમાન જ્યોતિઓ,

ઉજીવલંતી આંખ આવે સમીપે ને ફરી પાછી વળી જતી;

શાશ્વતી શબ્દ ઉચ્ચારે કિંતુ એનો શબ્દ કો સમજે નહી;

અનિષ્ટુ હોય છે ભાગ્ય, ને ગર્ત ઈનકારતો;

અચિત્કેરાં મનોહીન જલો રોધે સર્વ કાંઈ કરેલને.

જરાક જેટલો ઊંચો પડદો મનનો થતો.

જાણે છે જે જ્ઞાનવાનો તેઓ માત્ર જુએ અરદ્ધ સત્યને,

બળવાનો ચઢે છે જે

તે ચઢે છે માંડ માંડ નીચા માથાવાળા શિખરની પરે,
પ્રેમની ઘટિકા માત્ર અપાયે છે જંખાએ ભર હાઈને,
અધી કથા કહી એની અચકાઈ જાય છે ગૂઢ ચારણ;
મત્ય રૂપોમહી દેવો હજુ અત્યંત અલ્પ છે."

નિજ વ્યોમોમહી છૂપાં અવાજ ઓસરી ગયો.

પરંતુ દેવતાઓના દીપ્ત ઉત્તરના સમી
આતપી અવકાશોમાં થઈ આવી સાવિત્રી ત્યાં સમીપમાં.
સ્વર્ગને ધારતા સ્તંભો જેવાં ઊંચાં વૃક્ષોમાં થઈ વાધતી,
સ્કુરાયમાણ રંગોએ ભર્યો અંગવસ્ત્રે નિજ સજ્જાયલી,
શાશ્વત ભુવનો પ્રત્યે જ્વાલાવંતી બનેલી લાગતી હતી,
મહી-મંદિર આકાશી છતવાળું, ત્યાંથી યાત્રિક-હસ્તથી
અદૃશ્ય દેવતાધારે

ઉતારાતી આરતીના જેવી એ શોભતી હતી.

આવિષ્ણારી ઘડીકેરી આવી ભેટ સાવિત્રીના સ્વરૂપમાં:
જડસી દેહની આંખે મય્યાદિત થયા વિના

સર્વ કાંઈ ફરીથી સમજાવતાં

ઉંડાણોમાંહથી રાજા એને જોઈ રહ્યો હતો,

સ્વચ્છ આવિષ્ણારકેરી કમાનમાં

થઈ જોતાં નવેસર પમાયલી,

હતી એ ભુવનાનંદકેરા સૂચનના સમી,

તરસ્યા દેવતાઓને માટે અમૃતપાત્ર શી

એ કંડારી કઢાયલી,

અલૌકિક કલાકારકેરી એ અદૃશુતા ફૂતિ,

શુતિમૂર્તિ શ્વાસ લેતી હખડિરી સનાતન સ્વરૂપના,

હતી માધુર્યકેરી એ જ્વાળા સ્વણાર્ણિન-ગુંઝિતા.

પરિવર્તન પામેલું પ્રતિમા-મુખ કોમળું

સ્વયંપ્રકાશ સંકેત બન્યું એક અગાધતર સૂચિનો,

પવિત્ર જનમોકેરી સ્વર્ણપત્રી તકતી એક એ હતું,

વિશ્વપ્રતીક ગંભીર જિંદગીમાંહથી કોરી કઢાયલું.

અકલંકિત સુસ્પષ્ટ સ્વર્ગોના પ્રતિરૂપમાં
ભાલ એનું ઠળાયલું,
હતું ધ્યાનતણું પીઠ ને સુરક્ષા હતું ધ્યાનસ્થતાતણી,
હતું કક્ષા અને મંદહાસ્ય ચિંતાનિમજ્જન અવકાશનું,
એની વિચિંતતી રેખા પ્રતીકાત્મક વંક કો
હતી અનંતતાતણો.

અભોના વૃન્દ શી એની અલકાવલિમધ્યમાં
રાત્રિની પાંખની છાયે જાણે છાયાં એનાં આયત લોચનો
સોનેરી ચંદ્ર શા એના સ્વખશીલ ભાલવિસ્તારની તળે
વિશ્વને ધારતા પ્રેમ ને વિચારતણા બે સાગરો હતાં
આશ્ર્ય પામતાં જોઈ જિંદગીને અને પાર્થિવ લોકને
દૂરકેરાં સત્યોને દેખતાં હતાં.

એક અમર તાત્પર્ય એનાં ભર્ત્ય અંગોમાંહે બર્યું હતું;
સોનેરી ફૂલદાનીની ઉગ્ર રેખામહીં યથા
તથા તે લાગતાં છેતાં લયવાહી સિસકારો મુદાતણો
જે સ્વર્ગધામની પ્રત્યે પૃથ્વીકેરી મૂળી આરાધનાથકી
પ્રકટી ઉઠતો હતો,

ને જે શાશ્વત ચીજોની પૂર્ણતાની દિશા ભજી
થતો 'તો મુક્ત જીવંત રૂપકેરા સૌન્દર્યથી પુકારમાં.
પારદર્શકતા પાસી અદ્વિતીય જીવતા પરિવેષ્ટને
અભિવ્યંજક દેવીને કરી ખુલ્લી એની દૃષ્ટિ સમીપમાં.
બાહ્ય દૃષ્ટિ અને ભર્ત્યતણા ઈન્દ્રિયગ્રાહથી
છટકી જે જતી હતી,

મનોમોહક તે એના આકારોમાં રહેલી રૂપરાગતા
બની શક્તિતણી એક મૂર્તિ ચિત્ર અર્થસૂચનથી ભરી,
પોતાની કૃતિઓમાંના એક માનવ રૂપમાં
ફરીને ઉતરી નીચે આવતી ના કળાયે એ પ્રકારથી,
ઉત્કાંતિ પામતા વિશ્વે જે સ્વરૂપ હતું માટી પરે ખડું,
ને તરી આવતું 'તું જે સ્પષ્ટ સીધા જિંદગીના ઉઠાવમાં,
કોરી કઢાયલી દેવમૂર્તિ ભીતે વિચારની,

વહેતી ઘટિકાઓમાં પ્રતિબિંબન પામતી,
છાયામાં પદ્ધરાવેલી જડ દ્રવ્યે

જેમ કોઈ મહામંદિર-ગઢવરે.

મૂલ્યો મનતણાં અલ્પજીવી લુખ્ત થઈ ગયાં,
પાર્થિવી દૃષ્ટિનો ત્યાગ કર્યો દૈહિક ઈન્દ્રિયે,
અમરો બે મળ્યા આંખ સાથે આંખ મેળવીને પરસ્પર.

જાગીને ગાઢ જાદૂથી રોજના ઉપયોગના
બાહ્ય રૂપતણે વેશે છુપાવી જે રાખે છે આત્મ-સત્યને,
જાણીતાં ને લાડવાયાં અંગો મધ્ય થઈ અશ્વપતિ જુએ
નિજ પુત્રીતણે રૂપે લઈ જન્મ

આવેલા મહિમાવંતા ને અવિજ્ઞાત આત્મને.

ઉડી ભીતરની દૃષ્ટિમાંથી ઉઠયા તત્કાલ તાતને મને
વિચારો જેમને ભાન નિજ ક્ષેત્રમર્યાદાનું હતું નહીં.
મનનો સાંકડો માર્ગ કરી પાર

પ્રેમ એને જ્યાંથી વિલોકતો હતો
તે વિશાળાં અને ચિંતામણ ઉડાણની પ્રતિ
બોલ્યો પિતા પછી વાક્યો જે અદીઠાં શુંગોથી આવતાં હતાં.
શબ્દ થોડા અક્ષમાત નીકળેલા

પલટાવી શકે જીવન આપણું.

કેમ કે આપણી વાણીકેરા પ્રચુન્ન પ્રેરકો
તાત્કાલિક મનોવસ્થાકેરાં સૂત્રો વપરાશે લઈ શકે
અને અભાન ઓડોની પાસે શબ્દો ઉચ્ચારાવે અદૃષ્ટના.

"યાત્રી શાશ્વતતાકેરા, ઓ હે આત્મા!

છે આવેલો અહીંયાં તું અવકાશોથકી અમરધામના,
તારા જીવનનાં જંગી જોખમોને માટે છે શસ્ત્ર તે સજ્યાં,
યદૃષ્ટા ને કાળ માથે મૂકશે તું વિજયી પાય તાહરા,
સ્વપ્રભામંડલે ઘેર્યો ચંદ્ર તારા જેવાં સ્વખ નિખેવતો.
બલિષ્ઠ એક સાન્નિધ્ય હજી રક્ષા કરે તારા શરીરની.
છે સંભવિત કે સ્વર્ગો સાચવી તુજને રહ્યાં

આત્મા માટે મહાન કો,

પગલે પગલે તારે ચાલશે એ સહયાત્રી સમીપમાં,
વીજાવાદક એ તારા આત્માકેરી તંત્રીનો અંતરંગિણી,
તારામાં મૂક છે તેને એ સ્વરોમાં ઉતારશે.
પછી તમે બની જાશો વીજાઓ બે સગાઈ સાથ સ્પંદતી,
ભેદના ને મોદકેરા તાલમેળે એકરૂપત્વ ધારતી,
સમાન દિવ્ય તાનોમાં પ્રતિ-ઉત્તર આપતી,
પ્રાકટયે આણતી સૂરો નવા શાશ્વત વસ્તુના.

શક્તિ એક જ બન્નેને ચલાવશે
ને બન્નેને માર્ગદર્શન આપશે,

જ્યોતિ એક જ બન્નેની આસપાસ અને અંતરમાં હશે;
બહિષ્ઠ હાથ શું હાથ મિલાવીને
સ્વર્ગના પ્રશ્નરૂપી જે જિંદગી છે તેની સામે ખડાં થજો:
તોતિંગ છળવેશની

કારમી જે કસોટી છે તેહને પડકારજો.

ચઢી પ્રકૃતિમાંથી જા શુંગોએ દિવ્યતાત્ત્વાં;
સુખસૌભાગ્યનો તાજ ધારનારા દેવો સંમુખ થા ખડી,
મહત્તર પછી પામ પ્રલુને જે

કાલાતીત તારું આત્મસ્વરૂપ છે."

બીજરૂપ હતો શબ્દ આ ભાવી સર્વ વસ્તુના.

કો માહાત્મ્યતણે હસ્તે ખોલી નાખ્યાં
એના હૈયાતણાં દ્વાર તાળાએ બંધ જે હતાં
ને બતાવ્યું કાર્ય જેને માટે જન્મ પામ્યું 'તું ઓજ એહનું.
યોગની શુદ્ધિમાં જ્યારે ગહુને મંત્ર ઉિતરે
અંધ મસ્તિષ્કને ત્યારે કરી ક્ષુદ્ધ એનો સન્દેશ જાય ત્યાં
ને અંધારા અને અંશ કોષોમાં એ રાખે છે એહનો ધ્વનિ;
શ્રોતા સમજતો એક શબ્દરચિત રૂપને
ને નિર્દેશક એનામાં જે વિચાર તેના ધ્યાનમહીં રહી
મથતા મનના દ્વારા કરે યત્ન એ એને અવબોધવા,
પરંતુ સૂચનો ભાગ એને ઉજ્જ્વળ આવતાં,
પામતો એ ન એનામાં મૂર્ત્ત થયેલ સત્યને:

પછી પોતામહી એને પામવાને મૌન એ સેવતો, અને
શુતિનો ચૈત્ય-આત્માની ભેટો એને થતો ભીતરની મહીઃ
છંદોલયે ભર્યા સૂરે શબ્દકેરો ધ્વનિ આવૃત્તિ પામતો:
વિચાર, દૂષ્ટિ ને ભાવ અને ઈન્દ્રિયચેતના,
ને સત્તા દેહની જાતાં જલાઈ ત્યાં અનિવાર્ય પ્રકારથી,
ને મનુષ્ય સહે એક સંમુદ્દ્રા ને અમર્ત્ય પરિવર્તન;
સંવેદ એ બૃહદ્-ભાવ અને એક શક્તિરૂપ બની જતો,
સમુદ્ર સમ આવે છે સર્વ જ્ઞાન એની ઉપર ઉભટી:
હર્ષ ને શાંતિનાં નગ્ન સ્વર્ગોમાં એ સંચરે પલટાયલો

શુદ્ધ અધ્યાત્મ રશિમાં,

પ્રલુનું મુખ એ જોતો, સુણતો એ પારકેરી સરસ્વતીઃ
આના સમાન માહાત્મ્ય સાવિત્રીના જીવને ઉપ્ત ત્યાં થયું.
હવે અત્યસ્ત દૃશ્યોના નાટકે અંત આવિયો.

જાણીતી શક્તિઓમધ્યે વિચારે મગ્ન ચાલતી,
સ્પર્શાતી નવ વિસ્તારો વડે એ ને પરીઓની ઈશારતે,
હજી હતી ન પોતાની બૃહત્તાઓ, તેમની પ્રતિ એ વળી;
અજ્ઞાત માધુરીઓની ઘબકો ઘારતું હતું

પ્રલુબ્ધ ઉર એહનું,

પાસે એની હતાં હાવે રહસ્યો કો એક અદૃષ્ટ લોકનાં.
સિમતે સુહંત આકાશે પ્રાતઃકાળ આરોહી ઉપરે ગયો;
શિખરાગ્રથકી નીલ નીલમાલ સમાધિના
નંખાયેલો નભ્યો નીચે દિન દીપ્ત સંધ્યાના સ્વર્જવર્ણમાં;
પરિત્યક્ત પ્રકાશાંત વસ્તુ શો વ્યોમમાર્ગમાં

ચંદ્રમા ખવતો હતો,

ને તે લુલકણી સ્વખ-કિનારીની નીચે પાખ્યો નિમગ્નતા;
રાત્રિએ શાશ્વતીકેરી ચોકિયાત જવાલાઓ જાગતી કરી.

પછી સર્વ ફર્યું પાછું મનકેરાં ગુપ્ત ગઢવરની મહીઃ;
દિવ્ય વિહંગની પાંખો પર આવ્યું અંધારું એક ઉતરી
ને બહિરૂષ્ટિથી એની ઈન્દ્રિયોને સીલ ભીતરમાં કરી
ને ઉઘાડ્યાં ઉઘકેરાં ઊડાણો ધોર ધોર કૈ.

જ્યારે પરોઢિયું આવ્યું સરકીને
 રાત્રિકેરી છાયા-ચોકીમહી થઈ,
 નવી જન્મેલ જ્યોતિએ
 મુખદર્શનને માટે સાવિત્રીની ઈચ્છા ત્યારે કરી વૃથા:
 જાગ્યો મહેલ, જોયું તો ખાલી પોતે બન્યો હતો;
 હમેશાંના હર્ષકેરી હતી દૂર અધીશ્વરી;
 એનાં ચંદ્રપ્રભા જેવાં પગલાં રંગતાં ન 'તાં
 લસતાં ભેલનાં તલો:
 સૌન્દર્યે ને દિવ્યતાએ લુઈ લીધી હતી વિદા.
 ભાગી ગયો હતો હર્ષ દુંદ્રવાને માટે વિશાળ વિશ્વને.

ત્રીજો સર્વ સમાપ્ત.